

આવરણથી થતા ફાયદાઓ

- નીદળ નહીંવત
- ખાતરની બચત
- ઝડપી છોડનો વિકાસ
- રોગ જીવાત ઘટે

પારવવું:-

છોડની સારી વૃદ્ધિ થયાબાદ ખામણા દિઠ એક છોડ રહેવા દઈને વધારાના છોડ કાઢી નાંખવા હાઈશ્રીક તરબુચની ખેતીમાં છાટણી ખુબ મહત્વનો ભાગ ભજવે છે. જેમા શરૂઆતમાં એક મુખ્ય અને બીજી બે બાજુમાં શાખા રાખી બાકીની કાઢી નાખવી. આ કાર્ય જ્યારે તરબુચ નાના હોય ત્યારે કરવું. ફળની સંખ્યા કરતા કં પર ભાર મૂકવાનો હોય ત્યારે ફળ નાના હોય તે વખતે વધારાના ફળો તોડી નાખી સંખ્યા ઓછી કરવી જેથી બાકી રહેલા ફળોનો વિકાસ સારો થાય.

લણણી

તરબુચના ફળની પરિપક્વતા માટે નીચેના મુદ્રાઓ ધ્યાનમાં લેવા.

- પ્રકાઢને છેડે તણાવો સુકવા માટે
- ફળને આંગળીના ટકોરા મારતાં ભાતુ જેવો રણકાર આવે તો ફળ અપરિપવ છે જ્યારે વેરો બોંદો અવાજ આવેતો તે ફળ પરિપક્વ
- ફળના ડીટા આગળ લાગેલ વેલો લીસો અને બીલકુલ રુવાટી વગરનો દેખાયતો તરબુચ પાકી ગયું તેમ માની શકાય.

ઉત્પાદન

તરબુચનો પાક ૮૫ થી ૮૦ દિવસનો છે. તેમાં આધુનિક ખેતી પદ્ધતિ કરતા ફળોનું ઉત્પાદન હેક્ટર દીઠ ત૦ થી ૪૦ ટન જેટલું મળે છે.

અર્થકરણ:-

ટપક પદ્ધતિનો વાર્ષિક ખર્ચ (રૂ./દિ.) –	૧૦,૦૦૦/-
આવરણ (કાળુ પ્લાસ્ટિક) ખર્ચ (રૂ./દિ.) –	૧૫,૦૦૦/-
ખેતી ખર્ચ (રૂ./દિ.) –	૫૦,૦૦૦/-
કુલ ખર્ચ (રૂ./દિ.) –	૭૫,૦૦૦/-
કુલ આવક (રૂ./દિ.) –	૧,૭૫,૦૦૦/- થી ૨,૦૦,૦૦૦/-
ચોખ્ખી આવક (રૂ./દિ.) –	૧,૦૦,૦૦૦/- થી ૧,૨૫,૦૦૦/-



Navsari Agricultural University

તરબુચની આધુનિક ખેતીભાં ખાતર તથા પિયત વ્યવસ્થાપન



સંક્લન

ઇજ. બી.એમ. સોલીયા, ઇજ. એન.જી. સવાણી, ડો. સી.ડી. દેસાઈ, શ્રી. પી.એસ. મિસ્ત્રી,
ડો. એ.પી. ગોંગે, ડો. સી.એસ. દેસાઈ, શ્રી. કે.કે. પટેલ અને ડો. વી.પી. ઉસદીયા

જગ અને જમીન વ્યવસ્થાપન સંશોધન યુનિટ

નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી

વર્ષ : ૨૦૧૫-૧૬

તરબુય (Citrullus lanatus) ને અગ્રેજીમાં વોટરમેલન (Watermelon) કહેવાય છે. તરબુયનો પાક આર્થિક સમાન છે કારણ કે પાકા ફળો પાણીની ગરજ સારે છે જેથી તરબુયને રણનું અમૃતતરીકે ઓળખવામાં આવે છે. આ પાકના ફળમાં લોહતત્ત્વનું પ્રમાણ વધુ હોય છે અને આખા વર્ષ દરમ્યાન તરબુયનું વાવેતર થાય છે પરંતુ આ પાક ઉનાળામાં સારો થાય છે.

આબોહવા

તરબુયના પાકને સુંકુ અને ગરમ હવામાન વધારે માફક આવે છે. સુંકુ અને ઓછા ભેજવાળું વાતાવરણ તરબુયના વેલાને ઝડપથી વિકાસ માટે અનુકૂળ આવે છે અને આ તરબુયને પાકવાના સમયે જરૂરી છે. ઉનાળામાં સખત સૂર્યપ્રકાશના લીધે તરબુયની મીઠાશ વધે છે તેમજ રોગ અને જીવાતના પ્રણો ઓછા રહે છે.

સુધારેલી જાતો

૧.	સુગર બેબી/હની બેબી	૪.	દુર્ગા મીઠા
૨.	અરકા જયોતી	૫.	દુર્ગાપુર કેસર
૩.	અરકા મજાક	૬.	શીપર

જમીન અને જમીનની જાળવણી

તરબુયની ખેતી મુખ્યત્વે બધાજ પ્રકારની જમીનમાં કરી શકાય છે. તેમાય નદી ડિનારાની પટની જમીન ગોરાળું, રેતાળ જમીનમાં ફળોનું ઉત્પાદન વધારે રહે છે. તરબુયના પાકના વાવેતર માટે જમીન બરાબર બેંક કરી તૈયાર કરવી. જમીનની તૈયારી સમયે પાયાના ખાતરો આપી જમીનમાં ભેણવી દેવા.

વાવેતર: ૨ મીટર × ૧ મીટર મુજબ સામાન્ય રીતે પાકની વાવણી કરવામાં આવે છે.

પિયત

તરબુયની ખેતીમાં પિયત વ્યવસ્થા ખૂબજ અગત્યની છે. પાકને રેલાવીને પિયત આપવાથી ફળ પાણીના સંપર્કમાં આવવાથી અને ઉનાળાના સખત તાપને લીધે માઠી અસર થાય છે. વળી આવી રીતે ચીલાચાલું પદ્ધતિથી પિયત આપવાથી બે પિયત વચ્ચેના ગાળામાં શરૂઆતમાં વધારે બેજ રહે છે અને છેલ્દે ભેજની ખેંચ હોવાથી પાકના વૃદ્ધિ અને વિકાસ તેમજ ખાસ કરીને ફળના વિકાસ અવસ્થાએ માઠી અસર થાય છે જેના લીધે ઉત્પાદન ઓષ્ઠુ મળે છે. પરંતુ તરબુયના પાકને ટપક પિયત પદ્ધતિથી પિયત આપવામાં આવેતો પાકને સતત બેજ મળી રહે છે જેના લીધે મૂળનો વિકાસ સારો થાય છે. જેથી સારુ ઉત્પાદન મળે તે માટે ઉનાળામાં તરબુયના પાકને ૮

લીટર/કલાક ના ટપકણીયા છોડ દઈ અભધા થી ત્રાણ કલાક સુધી પાકના વેરાવા મુજબ પિયત આપવું.

ટપક પિયત પદ્ધતિ

લેટરલ અંતરઃ-	૨ મીટર
ટપકણીયાની સંખ્યા:-	બેછોડ વચ્ચે ૧
ટપકણીયા વચ્ચેનું અંતરઃ-	૧ મીટર
ટપકણીયાની ક્ષમતાઃ-	૮ લીટર / કલાક

ખાતર

જમીન તૈયાર કરતી વખતે હેક્ટર દીઠ ઉઠી ૪ ટન જેટલું સારુ કોહવાયેલું છાણીયું ખાતર છોડની નશીક રીગમાં આપવું.

હાઈબ્રિડ જાતનું વાવેતર કરવું હોય ત્યારે રાસાયણીક ખાતરનો જથ્થો ૧૫૦-૭૫-૭૫ ના.ફો.પો. ડિલો/દે. પ્રમાણે આપવો. આ ખાતર પૈકી ૧૦૦% ફોસ્ફરસ, ૧૦% નાઈટ્રોજન અને ૧૦% પોટાશ પાયામાં આપવા તથા બાકીનો નાઈટ્રોજન અને પોટાશનો જથ્થો બીજના ઉગાવાના ૧૫ દિવસ બાદના અઠવાડીયાના અંતરે ૬ સરખા ભાગમાં આપવા. જો જમીનમાં નિમેટોક્સ (કૂમિ) નો ઉપદ્રવ જોવા મળતો હોય તો શરૂઆતમાં જમીનમાં કાર્બોફિયુરાન દવા હેક્ટરે ૧૨ કિલો પ્રમાણે આપવી જોઈએ.

વાવેતર સમય

મુખ્યત્વે તરબુયના પાકની વાવણી જાન્યુઆરી / ફેબ્રુઆરી થી લઈ માર્ચના અંત સુધીમાં કરવામાં આવે છે. જમીનનું પત અને જમીનની ફળદુપ્તાને ઘણાનમાં રાખીને તરબુયનું ૨ મી. × ૧ મી. તથા ૧.૫ મી. × ૧ મી. ના અંતરે વાવેતર કરવામાં પણ આવેછે. આમ આ અંતરે વાવણી કરવામાં આવેતો હેક્ટર દિઠ ૩-૪ કિગ્રા જેટલા બીયારણ ની જરૂરીયાત રહે.

નીદણનિયંત્રણ

આ પાકના મૂળ ઉકા જતા નથી આથી નીદણનો નાશ કરવા માટે છીધરી આંતરખેડ કરવી. વેલા મોટા થયા બાદ ખૂરપીથી નીદણ કરવું.

આવરણ

તરબુયના પાકમાં ૮૦ થી ૮૦% નિંદણ નીયંત્રણ, રોગ જીવાત ઘટાડવા તથા ઉત્પાદન વધારવા હેતુ સર જો પ્લાસ્ટિક મલ્ટીગ્રામ તરીકે કાળા તથા સીલ્વર રંગના મલ્ટ્યનો ઉપયોગ કરવામાં આવેતો ઘણો ફાયદો થાય છે. શેરડીની રાળ, પરાળનો પણ ઉપયોગ કરી શકાય છે. મલ્ટીગ્રામ ૫૦% વિસ્તામાં ૨.૫ માઈક્રોન થી લઈ ૫૦ માઈક્રોન જાડાઈનું કરી શકાય છે.